

**હત્યાના ગુનામાં આજીવન કૈદની સજા પામેલ સને-૧૯૯૨ (૨૮ વર્ષ) થી પેરોલ જમ્પ કરી નાસતા હરતા આરોપીને રાજસ્થાન ઝુનઝુનુ ખાતેથી ઝડપી પાડતી, સુરત શહેર કાર્મ બ્રાંચ.**

સુરત શહેર વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સજા પામેલ અને ઘણા વર્ષોથી પેરોલ/હલો તથા વચગાળાના ખમીન મેળવી નાસતા હરતા આરોપીઓને પકડી પાડવા નાસતા હરતા/પેરોલ હલો રકોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે રાજસ્થાન ઝુનઝુનુ સીટીમાં આવેલ કાલવાડા વોર્ડ નં.૩૦ ખાતેથી આરોપી:- અનવરહુશેન મહંમદ યાસીન ઉ.વ.૫૯ ઘંઘો-કડીયાકામની મજુરી રહે.ઝુનઝુનુ સીટી કાલવાડા વોર્ડ નં.૩૦ તા.૭.ઝુનઝુનુ. (રાજસ્થાન) નાને પકડી પાડી સદર આરોપી તેના પરીવારની સાથે સને-૧૯૮૪ ની સાલમાં સુરત શહેરમાં ઉઘના હરીનગર વિસ્તારમાં રહી કડીયા કામની મજુરી કરતો હતો. તે વખતે તેણે તેની બાજુમાં રહેતા ઉરમાન હાજસત્તાર ખુરેશી નામના ઈસમની સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ઉઘના હરીનગર ખહેર રોડ ઉપર રોકી ચાકુના જીવલેણ ઘા મારી હત્યા કરેલ હતી. જેથી આ બાબતે ઉઘના પો.રે. હરટ ગુ.ર.નં-૩૨/૧૯૮૪ ઈ.પી.કો.ક.૩૦૨, મુજબથી ગુનો રજીસ્ટર થતા આરોપીને ગુનામાં અટક કરવામાં આવેલ દરમ્યાન સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા તા.૧૦/૦૯/૧૯૮૪ ના રોજ આરોપીને આજીવન કૈદની સજા થતા તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા હેઠળ રાખવામાં આવેલ હતો. દરમ્યાન મજકુર પાકા કૈદીએ તેની માતાની બિમારીની સારવાર કરાવવા સારૂ તા.૨૫/૦૭/૧૯૯૨ થી તા.૦૨/૦૭/૧૯૯૨ સુધી દિન-૦૭ ના પેરોલ રજા લેતા તેને વડોદરા મધ્યસ્થ જેલથી મુક્ત કરવામાં આવેલ અને તેને તા.૦૩/૦૭/૧૯૯૨ ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે સમય મર્યાદામાં જેલમાં હાજર નહીં થઈ પેરોલ જમ્પ થઈ નાસતો હરતો હતો. દરમ્યાન ડી.સી.બી.પો.રે.ના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે પકડી પાડવામાં આવેલ છે.

સદર આરોપી છેલ્લા ૨૮ વર્ષથી નાસતો હરતો હોય તેની પુછપરછ દરમ્યાન હકીકત જણાય આવેલ કે, તે પેરોલ રજા પરથી હરાર થયા બાદ પાર્સપોર્ટ દ્વારા અલગ અલગ દેશો સાઉથ આફ્રીકા, દુબઈ, અને સાઉદી અરબીયામાં રહી ત્યા કામ કરતો હતો. હાલ આશરે આઠેક વર્ષથી પોતાના વતન ખાતે આવી પોતાની સજા પુરી થઈ ગયેલ હોવાનું જણાવી રાજસ્થાન ખાતે રહી કડીયાકામની મજુરી કરતો હતો. સદર આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.